

CRESTCHEM LIMITED

Reg. office: Sr. No. 550/1, Sub Plot o. 12, Village Indrad, Taluka -Kadi, District- Mehsana, Pin code-382715, Gujarat.
Phone : +91-9409119484, Email : info @crestchemlimited.in GST Number : 24AAACC8722C1Z5
CIN NO. L24100GJ1991PLC015530/WEBSITE : www.crestchemlimited.in

Date: 25/08/2021

To,
BSE Limited,
Department of Corporate Services,
Bombay Stock Exchange Ltd.,
Dalal Street,
Mumbai- 400 001.

Ref .: SCRIPT CODE : 526269 Company Name : Crestchem Limited

Dear Sir,

Sub .: Announcement under Regulation 30 (LODR) – News Paper Publication

With regard to captioned subject, we enclosed herewith copy of e-newspaper of notice of 29th AGM and book closure has been published on Lokmitra Gujarati (Gujarati News paper) and Freepress Gujarat (English Newspaper) August 25 ,2021

This is for your information and records pursuant to Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015

Yours Truly

For, Crestchem Limited


Khyat Vyas
Company Secretary



GM, WR INTERACTED WITH PASSENGERS IN RUNNING TRAIN FOR THEIR VALUABLE FEEDBACK & SUGGESTIONS



Ahmedabad, Shri Alok Kansal - General Manager of Western Railway while travelling in Okha - Mumbai Superfast Special train, interacted with the passengers in the running train and took their valuable feedback regarding passenger convenience related services & also noted major suggestions to improve the services.

According to a press release issued by Shri Sumit Thakur - Chief Public Relations Officer of Western Railway, on 21st August 2021, GM undertook surprise inspection of Train No. 02946 Okha - Mumbai Superfast Special train and during the journey, also interacted with passengers from all classes. He discussed with the passengers about the problems faced by them during the train journey and also took feedback about the cleanliness in the coaches, toilets, regarding the behaviour of the railway

employees, etc. Several passengers mentioned that there has been a tremendous change in the experience of travelling in trains over the years. Passenger amenities have improved significantly, especially cleanliness inside trains, toilets, AC cooling, etc. While interacting with the passengers, some suggestions related to improvement in provision of wheelchair were given, taking cognizance of the suggestion, Shri Kansal immediately resolved the same. Detailed instructions were given. Shri Kansal also informed, in case of any grievances during train journey, passengers may call the Helpline no. 139 for immediate redressal. He further added that he would like every passenger to have a good experience during their travel. He informed passengers about the Rail Madad stickers in every coach on which complains/grievances can be registered

which will be attended instantly within 15 minutes. This is the motive of Western Railway, GM Shri Kansal also explained to the passengers that they should always purchase catering items from authorized vendors, both at stations as well as in trains and must also insist for bill before payments as per railway rules. He cited that Railways have implemented the initiative of "No Bill, No Payment" to curb the menace of overcharging by the vendors. Shri Thakur further informed that GM Shri Kansal also inspected the cleanliness of the coaches and toilets, checked the cooling system in the AC coaches and also instructed the staff to ensure proper pest control to rid the coaches of rodents & insects. He also laid special emphasis on the security of the passengers and informed that in case of any kind of security related issues, passengers should call the Helpline no.

139 for immediate help and RPF personnel will arrive at the next station for assistance. At Ahmedabad station, General Manager inspected the Current Ticket counters and took stock of the position. He ensured that there is no inconvenience to the passengers in getting tickets directly from the counters and that there is no delay, thereby saving their valuable time. Thereafter, based on his inspection, Shri Kansal gave instructions to the officers of Ahmedabad division for improvement of services. GM Shri Kansal emphasized upon the concept of "ANTYODAYA" & said that it should be our aim to serve the people from different walks of life and work towards providing the best facilities. During the course of inspection, GM was accompanied by Additional Divisional Railway Manager of Ahmedabad Division alongwith other senior divisional officers.

Fliptkart Wholesale rolls out new credit program to support kiranas & retailers

Ahmedabad, Fliptkart Wholesale, the digital B2B marketplace of India's homegrown Fliptkart Group, has announced the launch of industry-first credit programs which aim to help kiranas manage their working capital requirements and grow their business. Fliptkart Wholesale's credit offerings, including 'Easy Credit' in partnership with IDFC FIRST Bank, are in line with a series of initiatives undertaken to solve local pain points of kiranas in India and boost prosperity for them by making their business easier using technology. Through these new offerings, kiranas can avail credit in just two minutes at zero cost, through end-to-end digital onboarding in partnership with our preferred lending partner, IDFC FIRST Bank and other esteemed fintech institutions. The credit line will range from

Monsoon Store is live on Amazon.in

Ahmedabad, The Monsoon store is live on Amazon.in until Aug 31, 2021. Customers can get a host of exciting offers and deals on monsoon essentials, beauty and grooming products, health and hygiene, appliances, kitchen essentials, books and much more. As customers enjoy the monsoon season already, they can look forward to deal-dense offers from Lakme and Garnier cosmetics, skin and hair care products respectively to keep their skin glowing and hair smooth. Additionally, to keep the immunity at an all-time high



consumer can get great offers on the Cadbury Bournvita collection and much more across various categories. Customers can also use their voice to access the 'Monsoon Store' using Alexa on smart phones, shopping apps (Android only). Users can tap the mic icon on the app and say 'Alexa, go to the Monsoon Store' and land directly on the store. Here are some picks from Amazon.in's Monsoon Store with offers and deals from participating sellers. - Suit up for the monsoons with the self-packable rain cheater suit from Wildcraft. (19-10)

Myforexeye and FIEO to focus on the development of MSME sector in Gujarat

Ahmedabad, In line with the Gujarat Industrial Policy outlining various promotional measures for upliftment of MSMEs in the state, Myforexeye, India's leading B2B-based forex solutions company has tied up with FIEO (Federation of Indian Export Organisations) to provide innovative services to MSMEs in the state of Gujarat with an objective to empower and develop them, as outlined in the state MSME policy. These digital mobile app-based forex trading solutions will equip MSMEs with real time solutions towards increasing yield on export business transactions. "This initiative will truly support our members in leveraging the benefits of

technology, savvy market intelligence, global trends and trainings in the forex domain so as to gain better cost advantage. Our association with Myforexeye is seamlessly B2B-based forex solutions company has tied up with FIEO (Federation of Indian Export Organisations) to provide innovative services to MSMEs in the state of Gujarat with an objective to empower and develop them, as outlined in the state MSME policy. These digital mobile app-based forex trading solutions will equip MSMEs with real time solutions towards increasing yield on export business transactions. "This initiative will truly support our members in leveraging the benefits of

Seize the summer with sporty new Starbucks® X FILA collection

Ahmedabad, This summer, Starbucks is collaborating with iconic sport style brand FILA for the first time to offer an exclusive, co-branded collection of sporty street style essentials that seamlessly combine fashion, function, and on-trend design. The collection is available exclusively to customers in Asia Pacific for a limited time only. Commenting on the collaboration, Deepa Krishnan, Director - Marketing, Category, Loyalty, Digital, Tata Starbucks Private Limited said "We are delighted to partner with an iconic brand like FILA. The

was designed with the intent to marry Starbucks' longstanding heritage with FILA's spirit of fitness and athletics. We are excited to bring this new range to our customers in India". Blending Starbucks' rich brand heritage with FILA's classic aesthetic and modern design, the Starbucks® X FILA collection showcases bold yet timeless designs in FILA's signature white, navy and red. The must-have merchandise items feature drinkware and lifestyle accessories that energize adventure-seekers and trendsetters alike to seize the summer. (19-10)

Academy Award Winner actor Emma Stone talks about portraying Cruella



Ahmedabad, From Estella to Cruella, what brought out the devious nature of a simple girl; Disney+ Hotstar brings Cruella that's made to take the world by storm. Cruella is the bad, cruel, and ruthless world which turned Estella into Cruella. Cruella personified an edgy and witty attitude which made her one of the most iconic villains of the Disney's universe. Reviving the strong personality, Academy award winning actor Emma Stone will be seen playing this enigmatic character in the film Cruella, premiering on 27 August only on Disney+ Hotstar in English, Hindi, Tamil, and Telugu.

Bringing back nostalgia with a pinch of quirk and sass, the movie will trace the journey of Estella becoming London's notorious fashionista and the character who provides the how she bagged the role, actor Emma Stone said, "I met with the folks at Disney. They were playing around with the idea of an origin story of Cruella de Vil and wanted to know if I would be interested. There was a lot to figure out and to see if it made sense to tell a story about her. But the character's so much fun and so intoxicating, they had an interest in finding what that story could be." (19-10)

Niva Bupa launches Personal Accident Plan to ensure its customers live carefree

Ahmedabad, Niva Bupa Health Insurance Company Limited, formerly known as Niva Bupa Health Insurance Company Limited - one of India's leading standalone health insurers, has introduced a standalone Personal Accident Plan to financially secure policy owners and their family members in case of death, partial, temporary, or permanent disability. The plan has been designed with the objective to urge customers to live life the way it is meant to be lived - minus any fear. The concept behind the product is launched with 'live it up' campaign which encourages customers to live life to the fullest. The Personal Accident Plan offers sum insured of up to 25 times of annual income. One of the key

highlights of the Personal Accident Plan is the Temporary Total Disablement (TTD) benefit which provides up to Base Sum Insured per week (maximum of INR 1 lakh per week) to provide financial support to policyholders to compensate for the temporary loss of income that may happen in case of an accident. The company is also providing TTD for non-earning members at 1% of Base Sum Insured per week (maximum INR 25K per week) as well. This benefit will be provided even for incidents such as Corona & Burns. The company is also providing an additional benefit which will protect people from the outstanding principal amount of the loan in case of death of the policyholder. This will ensure protection of financial liability & assets, providing security to the families. (1-7)

CRESTCHEM LIMITED

CIN Number : L24100GJ1991PLC015530
Reg. Off. - Sr. No. 550/1, Sub Plot No. 12, Village - Indrad, Taluka - Kadi, District - Mehsana, Pin code - 382715, Gujarat
Phone : +91 - 9409119484
Email : info@crestchemlimited.in www.crestchemlimited.in

NOTICE OF 29TH AGM & BOOK CLOSURE & E-VOTING

Notice is hereby given that 29th AGM of the Crestchem Limited will be held on Thursday, 23rd September, 2021, at 12:15 P.M. (noon) through Video Conferencing (VC) or other Audio Visual Means (AVM). In accordance with section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014, as amended from time to time and Regulation 44(1) of SEBI (LODR) 2015, the Company is providing to the Members the facility to cast their vote at the AGM through e-voting facility being provided by Central Depository Services (India) Limited (CDSL). The details regarding the Companies Act, 2013 and rules made there under are given below:
1) Duration: Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015 and section 91 of the Companies Act, 2013 and applicable rule thereunder, The Register of Members and transfer books, as per the provisions of Companies Act, 2013 and the Companies (Management & Administration) Rules, 2014 shall be closed from 21st (both days inclusive) for the purpose of AGM for the year ended on 31st March, 2021.
2) E-Voting: In the resolutions to be passed at the said AGM of the Company shall begin on 20th September, 2021 (09:00 a.m.) to 22nd September, 2021 (5:00 p.m.) (Both days inclusive). As on the Cut off (Record Date) of date 13th September, 2021, the members holding the shares in the Company shall be entitled to vote.
3) The Annual Report for the FY 2020-21 containing Notice Convening the 29th AGM is being Emailed (On the email id registered with the Company/ listed on the website of the company).
4) The aforesaid documents will be also available on the website of the Company www.crestchemlimited.in and CDSL www.evotingindia.com.
5) CS Nehal Ravi, Practising Company Secretary (Membership No: AZ8155; CP No: 10500), has been appointed as the Scrutinizer to scrutinize the Voting process.
6) Detailed process and manner of casting votes and Video Conferencing (VC) or OAVM are provided in the annexure to the Notice of AGM sent to the Members along with Annual Report for the year 2020-21.
7) The member may note (i) the remote e-voting module shall be disabled for voting after the date and time mentioned under point 2 above (ii) once the vote cast by a member, the member shall not be allowed to change it electronically (iii) the facility of voting through electronic voting shall be made available at the AGM (iv) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again at the meeting (v) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or voting at the AGM.
8) The Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI) have permitted the listed companies to send the Notice of the Annual General Meeting (AGM) and the Annual Report during the calendar year 2021 to shareholders by email only in view of prevailing COVID-19 pandemic situation and difficulties involved in dispatch of physical copies. As per MCA and SEBI circulars the company is holding its Annual General Meeting (AGM) through VC/OAVM, for the said purpose the company has engaged the service of Central Depository Services Limited (CDSL) for conducting AGM through VC/OAVM.
9) Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.
10) Manner of registering/updating email address for receiving the documents pertaining to 29th AGM : For permanent registration / updation of the email address, members may send their request as given below: a) For shares held in physical form: - To the RTA at Link Intime India Pvt. Ltd., 506-508, Amarnath Business Centre-I, (ABC-1), Besides Gala Business Centre, Near, St Xavier's College, Corner Off C G Road, Ellisbridge Ahmedabad - 380006. Providing folio no., Name of member, scanned copy of share certificate (front and back), self attested copy of Pan card and address proof. b) For shares held in dematerialized form: - with the Depository Participant (DP) where the demat account is maintained as per the process advised by your Depository Participant (DP).
11) We urge the shareholders to update their e-mail ID, Bank account details & permanent Account Number (Pan) with the RTA / Depository participant to ensure receipt of the Annual Report and other communication form the Company.
FOR, CRESTCHEM LTD. Sd/- Khyati Yyati Company Secretary

Date : 25-08-2021
Place : Indrad (Kadi)
Date : 24.08.2021
Place: Surat

Experience Excitement Every Day with the most awaited Hyundai i20 N Line, Bookings Now Open



Ahmedabad, Hyundai Motor India Ltd., country's first Smart Mobility Solutions Provider and largest exporter since inception, today unveiled and opened bookings for its highly anticipated i20 N Line, the first model to debut under Hyundai's N Line range of cars for India. Deriving inspiration from Motorsports styling, i20 N Line fuses exhilarating style with a dynamic driving experience to deliver excitement every day. Customers can now book i20 N Line online on the Hyundai Click to Buy platform: <https://clicktobuy.hyundai.co.in> or at Hyundai Signature Dealerships across the country for Rs 25,000/- only.

Commenting on the unveiling of i20 N Line, Mr. S S Kim, MD & CEO, Hyundai Motor India Ltd., said, "At Hyundai we aspire to breathe life into dreams, ideas and imagination, creating smart mobility solutions that ignite the senses and realize the aspirations of our customers. The N Line range will introduce customers to a car that truly epitomizes driving passion, making sure sporty and fun driving experiences are accessible to all. Our first model to spearhead the range introduction to India, the i20 N Line has now been unveiled, once again showcasing our commitment to redefining mobility for Indian customers. Hyundai i20 N Line personifies the fusion of driving excitement, energetic design and advanced technology, to create a car that truly delivers everyday excitement." (1-7)

Gujarat: Angadia firm employee decamps with Rs 12 lakh

Ahmedabad : An employee of an angadia firm has been booked for cheating after he decamped with Rs 12 lakh on Saturday. The Karelibaug police have registered an offence against Prashant Mehta, a resident of Tarsali, and started an operation to track him. Kanu Patel, who filed the complaint, told the police that Mehta was given Rs 12 lakh cash that was to be taken to the angadia firm's other branch in Akkapur.

केन्द्रीय विश्वविद्यालय
CENTRAL UNIVERSITY OF KERALA
Teppanam Hills, Puzhuvil (PO), Kasaragod (Dist), Kerala - 671320

संसर्गसूची 2021/CUCET 2021
केन्द्रीय विश्वविद्यालय/Central University of Kerala
यू.जी./सी.जी प्रवेश 2021 - UG/PG Admissions 2021
अवेदन देने की अंतिम तारीख/ Application Deadline
01-09-2021
अधिक जानकारी के लिए/For more details:
www.cukerla.nic.in, www.cukerla.org.in
दृष्टि 21353/11/0004/2122

BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED
CIN: L32106GJ2008PLC53336
Regd. Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002
Website: www.bhatiamobile.com,
mail: info@bhatiamobile.com, Ph: 0261-2349892

PUBLIC NOTICE - 13TH ANNUAL GENERAL MEETING

This is to inform that in view of the outbreak of the Covid-19 pandemic, the 13th Annual General Meeting ("AGM"/Meeting) of Bhatia Communications & Retail (India) Limited (the "Company") will be convened through Video Conferencing (VC) or other audio visual means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder, read with General Circular dated April 12, 2020 and General Circular dated April 13, 2020, General Circular dated May 5, 2020, General Circular dated January 13, 2021 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular dated April 12, 2020 and January 15, 2021 issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars").

The 13th AGM of the Members of the Company will be held at 11:00 a.m. (IST) on Wednesday, September 22, 2021 through VC/ OAVM facility provided by the National Securities Depositories Limited ("NSDL") to transact the business as set out in the Notice convening the AGM. The e-copy of 13th Annual Report of the Company for the Financial Year 2020-21 along with the Notice of the AGM, Financial Statements and other Statutory Reports will be available on the website of the Company at www.bhatiamobile.com and on the website of NSDL at www.evoting.nsdl.com. Additionally, the Notice of AGM will also be available on the website of the stock exchange on which the securities of the Company are listed i.e. at www.bseindia.com.

Members can attend and participate in the AGM through the VC/OAVM facility ONLY, in person to ensure compliance with the COVID-19 protocols. Members attending the Meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

Members will have an opportunity to cast their vote(s) remotely through remote e-voting system and can cast their vote(s) through e-voting system during the AGM on the item(s) of business as set out in the Notice of AGM.

The Notice of the AGM along with the Annual Report 2020-21 will be sent electronically only to those Members whose e-mail addresses are registered with the Company / Registrar & Transfer Agents ("Registrar") electronically, and to receive login ID and password for remote e-voting; Depository Participants ("DPs"), as the case may be. As per the SEBI Circular, no physical copies of the Notice of AGM and Annual Report will be sent to any Member. The manner of voting for members holding shares in dematerialized form and for members who have not registered the email addresses will be provided in the Notice of AGM.

REGISTRATION OF E-MAIL ADDRESSES

Members who have not yet registered their e-mail addresses are requested to follow the process mentioned below, for registering their e-mail addresses to receive the Notice of the AGM and Annual Report 2020-21 electronically, and to receive login ID and password for remote e-voting:


- In case shares are held in physical mode please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to csbhatia@bhatiamobile.com
- In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to evoting@nsdl.com in addition to providing User ID and Password by providing the details mentioned above.

FOR UPDATING OF BANK ACCOUNT DETAILS

Shareholder(s) holding shares in dematerialized form are requested to notify changes in Bank details with their respective DPs. For Shareholders who have not updated their bank account details, dividend warrant cheque will be sent to their registered address once the postal facility is available.

For Bhatia Communications & Retail (India) Limited
Sd/- Mittal Shah
Company Secretary

"CAMOUFLAGE WITH ŠKODA": SHORTLISTED DESIGNS ANNOUNCED



Ahmedabad, ŠKODA AUTO India has received an overwhelming response to the design contest it organised for budding Indian designers to design a camouflage for its upcoming mid-size premium sedan. More than 200 entries were received from across India for the contest which was open till 18th August 2021. The top five entries shortlisted by the jury were announced today and one final winner will be announced from among the top five shortlists in October, 2021.

The contest was judged by Mr. Gurpratap Bopari, Managing Director - SAVVIPL, Mr. Zac Hollis, Brand Director - ŠKODA AUTO India and Mr. Oliver Stefani, Head of Design

and technical expertise. Each design was judged for its innovation, aesthetics, functionality, ergonomics, impact, utility and the emotional quotient. Zac Hollis, Brand Director - ŠKODA AUTO India, said, "India has a rich design heritage and we wanted to start activities for our all-new mid-size premium sedan by giving an opportunity for budding Indian talent. Like with KUSHAQ, our new offering will also have close collaboration between our design teams in the headquarters and India, and this unique initiative was conceptualised based on this partnership. The sheer number and quality of entries that we have received for the contest reflects the design talent in India, and also the deep interest in the ŠKODA brand." My heartiest congratulations to the top 5 shortlisted designers, and also to all the designers who participated in the "Camouflage with ŠKODA" contest." (19-10)

